



ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છઠ્ઠો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલથાણ રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

Ref no. PN 2025-26/155

Dt. 24/09/2025

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(સેક્રેટરી)

કામદારોના આરોગ્ય માટે ચિંતન: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણ મંત્રાલય અને અન્ય સંસ્થાઓના સહયોગથી જાગૃતિ સત્ર યોજાયું

સુરત: ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર), રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા અને આજીવિકા બ્યુરોના સહયોગથી મંગળવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૫:૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે 'કામદારોના આરોગ્ય પર વાયુ પ્રદૂષણ, ઘોંઘાટ અને ગરમીના તણાવની અસર' વિષે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ આવકાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચેમ્બર હંમેશા આવા જાગૃતિ કાર્યક્રમો યોજી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. આજનું સત્ર ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી સ્થાનિક ઉદ્યોગને નવી દિશા મળશે અને કામદારોનાં આરોગ્ય પ્રત્યે તેઓ વધુ સંવેદનશીલ બનશે.

આઈસીએમઆર- નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થના ટેકનિકલ ઓફિસર શ્રી સંજય કોટડિયાએ ધ્વનિ પ્રદૂષણ અને વધુ પડતી ગરમીની આપણા શરીર પર થતી અસરો વિશે વિગતે સમજણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, અવાજ કરતા મશીનો જ નહીં, એરપોઝ-હેડફોન વગેરેથી ગીતો સાંભળવાથી પણ આપણા કાન પર વિપરિત અસરો થાય છે. સુરતમાં એમ્બ્રોઈડરી, વિવિંગમાં મશીનોથી અવાજ વધુ થાય છે. જેને કારણે ૩૦%

કામદારો એનાથી પીડાય છે. ધ્વનિ પ્રદૂષણથી આવતી કામચલાઉ અને કાયમી બહેરાશ વિશે સમજણ આપતા તેમણે કહ્યું કે તેને અમુક પગલાં લઈ અટકાવી શકાય છે પણ કાયમી બહેરાશ આવી જાય તો એને પલટાવી શકાતી નથી.

વધુમાં તેમણે સમજાવ્યું હતું કે કાર્યસ્થળે જો ૩ ફૂટ દૂરથી પણ મોટા અવાજે વાત કરવી પડે તો સમજી જવાનું કે તમે ઘોઘાટિયા વાતાવરણમાં કામ કરો છો. એવામાં હિયરિંગ પ્રોટેક્ટિવનો ઉપયોગ કરી શકાય છે. કામના સ્થળોએ જ નહીં, પણ આપણી આસપાસ પણ આપણે ધ્વનિ પ્રદૂષણથી સચેત રહેવાની જરૂર છે. મોટા અવાજે વાગતા ડીજે પાસેથી પસાર થવામાં હાર્ટ રેટ વધી જાય છે. સતત હેડફોન લગાવીને કામ કરવાથી કાનમાં ચેપનું જોખમ પણ રહે છે અને તે ખતરનાક પણ છે, કાન મગજ સુધી જાય છે, એટલે એને પણ નુકસાન થઈ શકે છે. ધ્વનિ પ્રદૂષણથી કેવી રીતે બચવું તેની ટિપ્સ આપતા તેમણે કહ્યું કે અમારી સંસ્થા પણ ઘણાં પગલાં લે છે. અમે અવાજનું પ્રદૂષણ માપીએ, પર્સનલ નોઈઝ ડેસિબીટર પણ લગાવીએ. આ બધા અત્યાધુનિક ઉપકરણો છે.

આઈસીએમઆર— નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થના ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી મોહમ્મદ ઈદ્રિશ શેખે હવાના પ્રદૂષણની અસરો વિશે સમજણ આપી હતી. તેમણે હવાનું પ્રદૂષણ કરતા ઘટકો વિશે વાત કરી, તેની આરોગ્ય પર થતી માઠી અસર વિશે સમજણ આપી હતી અને કેવી રીતે તેને ઘટાડી શકાય તેના ઉપાયો પર વાત કરી હતી.

ચેમ્બરની ચેમ્બરની એન્વાયરમેન્ટ, પોલ્યુશન કન્ટ્રોલ અને વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન શ્રી કુન્દાલ શાહે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં કોલસા, વધુ અવાજ કરતા મશીનો સહિતના પરિબળોને લીધે કામદારો પર તેની ઘેરી અસર થતી હોય છે, સામાન્ય રીતે તેનો ખ્યાલ જ નથી આવતો કે લાંબા ગાળે શું અસર થાય છે, આથી કામદારોનું આરોગ્ય પણ સાચવવાનું છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ— અમદાવાદના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી પારૂલ વત્સ અને ઇન્ફોર્મેશન ઓફિસર શ્રી અજય નીરજે એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન, અવેરનેસ, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ લાઇવલીહુડ પ્રોગ્રામ વિષે માહિતી આપી હતી.

આજીવિકા બ્યુરોના અધિકારી શ્રી શરદ ઝગાડેએ જાગૃતિ સત્રમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચેમ્બરના માનદ્ બજાનચી શ્રી મિતિષ મોદી, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ડેપ્યુટી સેક્રેટરી શ્રી પૌલિક દેસાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.